



ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ

(ગુજરાત સરકારનું સાહસ)

અધિક્ષક ઇજનેરશ્રી (દ.ગુ) ની કચેરી,

નાનપુરા, ગુ.ઔ.વિ.નિ., સુરત..

ફોન નંબર (૦૨૬૧) ૨૪૭૩૭૨૯

જાહેર નિવિદા નં.૦૩ /૨૦૧૯-૨૦

અધિક્ષક ઇજનેરશ્રી(દ.ગુ), જી.આઇ.ડી.સી., સુરતનાં તાબા હેઠળ આવેલ કાર્યપાલક ઇજનેરશ્રી, જીઆઇડીસી, વાપી ફોન:૦૨૬૦-૨૪૩૦૮૮૩ હસ્તકનાં અ.નં.૦૧ થી ૦૭ કામની અંદાજીત કિંમત રૂ. ૪.૮૫ લાખ થી રૂ.૧૦૨૧.૪૪ લાખની વચ્ચે છે. આ કામ માટે અ.નં. ૧ ઓફલાઇન ટેન્ડર પધ્ધતિથી તથા અ.નં. ૨ થી ૭ ઓનલાઇન પધ્ધતિથી મંગાવવામાં આવે છે.

ઓફલાઇન કોરા ટેન્ડર ફોર્મ ઇસ્યુ કરવાની તારીખ.૨૬/૦૮/૨૦૧૯ થી તા.૦૬/૦૯/૨૦૧૯ કચેરી સમય દરમિયાન કાર્યપાલક ઇજનેરશ્રી, વાપીની કચેરીમાંથી જારી કરવામાં આવશે. ભરેલ-પત્રકો સ્વીકારવાની આખરી તા.૧૬/૦૯/૨૦૧૯ સમય સાંજે ૧૭:૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે અને આવેલ ટેન્ડરો આશરે તા.૧૭/૦૯/૨૦૧૯ ના રોજ ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે.

ઓનલાઇન ટેન્ડર માટે ટેન્ડર ભરવાની કાર્ય પધ્ધતિ, સંબંધિત વિગતો જેવી કે ટેન્ડર ફી, EMD વગેરેની માહિતી વિગતવાર ટેન્ડર નોટીસમાં આપવામાં આવેલ છે. જે રસ ધરાવતાં ઇજારદારોએ વંચાણે લેવા વિનંતી છે. જે એક ટેન્ડર એગ્રીમેન્ટનો ભાગ છે.

ઓનલાઇન ટેન્ડર કરવાની તારીખ ૨૬/૦૮/૨૦૧૯ થી ૨૧/૦૯/૨૦૧૯. ભરેલ ટેન્ડર સ્વીકારવાની આખરી તારીખ ૨૩/૦૯/૨૦૧૯ અને ૨૪/૦૯/૨૦૧૯ સમય સાંજે ૧૭:૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે અને આવેલ ટેન્ડરો તા.૨૫/૦૯/૨૦૧૯ ના રોજ ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. અ.નં.૦૨ માટે પ્રી-બીડ મીટીંગ તા. ૦૫/૦૯/૨૦૧૯ ના રોજ ૧૨.૦૦ કલાકે સ્થળ:અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જીઆઇડીસી, વિકાસ બિલ્ડીંગ, ૬૫ ગાર્ડન રોડ, નાનપુરા, સુરત :- ૩૯૫ ૦૦૧

આ કામોની વિગતવાર જાહેર નિવિદા ઓફિસનાં નોટીસ બોર્ડ ઉપર, જી.આઇ.ડી.સી.ની વેબસાઇટ www.gidc.gov.in તેમજ માહિતી ખાતાની www.statetenders.comમાં જોઇ શકાશે. વધુ માહિતીની જરૂરિયાત હોય તો, જે તે સંબંધિત કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીએથી કામકાજનાં સમય દરમિયાન મેળવી શકાશે. સદર કામોનાં દસ્તાવેજી પુરાવાનાં કવર ઉપર કામનું નામ, ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ તેમજ ટેન્ડરો ખોલવાની તારીખ અવશ્ય લખવાની રહેશે. વેક્સ અથવા ટેપથી સીલ કર્યા વગરનાં કવરો સ્વીકારવામાં આવશે નહિ. બાના મુક્તિ પ્રમાણપત્ર ગ્રાહ્ય/સ્વીકાર્ય નથી જેની નોંધ લેવી. નિવિદામાં જણાવેલ કોઇ પણ અથવા બધા ટેન્ડરો કારણ જણાવ્યા વગર સ્વીકારવા, ન સ્વીકારવા, રદ કરવા એ નિગમનો અબાધિત અધિકાર છે. જે તમામને બંધનકર્તા રહેશે. અધિકૃત વેબ-સાઇટ પર ટેન્ડરને લગતા તમામ સુધારા / વધારા ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ સુધી જોઇ શકાશે.

અધિક્ષક ઇજનેર (દ.ગુ)

ગુ.ઔ.વિ.નિ., સુરત.